

ત્વરિત જાહેરાત માટે

## બ્રેમ્પટનમાં રિવરસ્ટોન કમ્યુનિટી સેન્ટર હવે ખુલ્લું મૂકવામાં આવ્યું છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જુલાઈ 7, 2022) – સીટી ઓફ બ્રેમ્પટનનું સૌથી નવું કમ્યુનિટી સેન્ટર, રિવરસ્ટોન કમ્યુનિટી સેન્ટર, હવે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

રિવરસ્ટોન કમ્યુનિટી સેન્ટર અદ્યતન સોલ્ટવોટર પૂલ, વિસ્તારેલા ચેન્જ રૂમ્સ અને ફિટનેસ રૂમ્સ અને સંખ્યાબંધ મલ્ટી-પરપઝ (બહુવિધ-હેતુઓ માટેના) રૂમોવાળી 34,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી નવીનીકરણ કરેલી મનોરંજનલક્ષી સગવડ છે. નવા કમ્યુનિટી સેન્ટરમાં ફિટનેસ એરિયા, સ્કવોશ કોર્ટ્સ અને ઘણી સગવડો છે.

રિવરસ્ટોન કમ્યુનિટી સેન્ટર બ્રેમ્પટનમાં 195 Don Minaker Drive (ડોન મિનાકર ડ્રાઈવ) પર સ્થિત છે. વેબસાઈટ [www.brampton.ca/riverstone](http://www.brampton.ca/riverstone) પર સંપૂર્ણ સુવિધાઓની યાદી જુઓ અને કાર્યક્રમો માટે નોંધણી કરાવો.

### ક્વોટ્સ (અવતરણો)

“અમે બ્રેમ્પટનમાં આપણાં શહેરનું સૌથી નવું રિક્રિએશન સેન્ટર, રિવરસ્ટોન કમ્યુનિટી સેન્ટર શરૂ થવાથી રોમાંચિત છીએ. નવીનીકરણ કામગીરીઓમાં આરોગ્ય અને સુરક્ષા સગવડોમાં તબદીલીઓ, સોલ્ટવોટર પૂલ માટે એક્સેસિબલ (પહોંચ સુલભ) રેમ્પ, ફિટનેસ સાધનોની તબદીલી અને ઘણી સગવડોનો સમાવેશ થાય છે. હું દરેક વ્યક્તિને સગવડની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરું છું.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“બ્રેમ્પટન એક આરોગ્યપ્રદ અને સુરક્ષિત શહેર છે અને અમે આપણાં સમુદાયમાં દરેક વ્યક્તિ માટે પહોંચ સુલભ તકો પૂરી પાડવા સમર્પિત છીએ. રિવરસ્ટોન કમ્યુનિટી સેન્ટર એક ઉત્કૃષ્ટ ઉમેરો છે જે સમગ્ર બ્રેમ્પટનને સેવા આપશે.”

- રોવિના સેન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસીસ, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટી કર્મચારીઓ સમર્થકોને રિવરસ્ટોન કમ્યુનિટી સેન્ટરમાં આવકારવા આશાવાદી છે. 34,000 ચોરસ ફૂટની સગવડ આપણાં સમુદાયના આરોગ્ય અને સુખાકારી કાર્યોને શ્રેષ્ઠ રીતે સેવા આપવા અદ્યતન કરવામાં આવી છે.”

- પૉલ મોરિસન (Paul Morrison), વચગાળાના મુખ્ય વહીવટી અધિકારી (ઈન્ટરીમ ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર), સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca)

### મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

[multiculturalmedia@brampton.ca](mailto:multiculturalmedia@brampton.ca)